

નિતીન એલ.પટેલ

લક્ષ્મણપુરા (વડગામ)

મું.પો.તા- વડગામ , (બ.કાં.) -

૩૮૫૪૧૦ તા. ૦૬.૦૩.૨૦૧૯

પ્રતિ શ્રી કાર્યપાલક ઈજનેર શ્રી,

સિંચાઈ વિભાગ બનાસકાંઠા.

વિષય : **વડગામ તાલુકાની ભૂગર્ભ જળ સમસ્યા બાબત .**

માનનિય સાહેબ,

સવિનય ઉપરોક્ત વિષય ના સંદર્ભે આપ શ્રીને વિદિત કરવાનું કે વડગામ તાલુકા અને આસપાસ ના વિસ્તારો મા ભૂગર્ભ જળ ની સમસ્યા એ કાયમી સમસ્યા છે. પ્રતિકુળ ભૌગોલિક પરિસ્થિતિ અને અપુરતા વરસાદને કારણે ભૂગર્ભ જળ દરવર્ષે ઊંડા ને ઊંડા ઉતરતા જાય છે તે સ્થિતિમા વડગામ તાલુકાના ભૂગર્ભજળ જળવાઈ રહે તે હેતુ મુખ્ય ડેમો માંથી નહેરો કે પાઇપ લાઈન મારફતે વડગામ તાલુકામા આવેલા કુદરતી અને કુત્રિમ તળાવો ભરવામાં આવે તો ભૂગર્ભ જળ ની સમસ્યા કાયમી ધોરણે હલ કરી શકાય એવો એક અંદાજ છે.

વડગામ પંથકમાં ઘણા એવા તળાવ છે જેના નૈસર્ગિક સૌન્દર્ય ને જાળવી તાલુકાની ભૂગર્ભ જળ ની સમસ્યા કંઈક અંશે હળવી કરી શકાય. વડગામ તાલુકામાં જલોત્રાનું કરમાવાદ , ફતેગઢનું બલાસર , વડગામનું સમશેર સાગર તળાવ, મગરવાડાનું તળાવ તેમજ અન્ય નાના મોટા તળાવો આવેલા છે એમાંય જલોત્રામાં આવેલું

કરમાવાદ તળાવ ભરવાની તાલુકાના લોકો ની વર્ષો જૂની માંગણી અને લાગણી છે. વડગામ તાલુકાના જલોત્રા ગામની પહાડીઓ માં આવેલું એટલે કે ટુંડેશ્વરના ભાંખરાથી ગુરૂના ભાંખરા સુધી વિસ્તરેલું અને આશરે ૫૦૦ એકરમાં ફેલાયેલું વિશાળ કરમાવાદ તળાવ અનેક રહસ્યમય અને રસપ્રદ ઘટનાઓ ઇતિહાસના પાને ધરબીને બેઠું છે એટલું જ નહિ વડગામ તાલુકાની ભૂગર્ભ જળ સમસ્યાઓ ઉકેલવામાં આશીર્વાદરૂપ બની શકે એમ છેકુદરતી ઘટનાકર્મના લીધે તળાવ એના નૈસર્ગિક ... જળસ્ત્રોતો ગુમાવી ચૂક્યું છે.

કર્માવાદ તળાવ ને લઈને વર્ષો પહેલા માર્કેટ યાર્ડ ના સ્થાપક પ્રમુખ સ્વ.શ્રી લાલજીમામાં અને તાલુકાના અન્ય આગેવાનો દ્વારા આ બાબતે સરકારશ્રીમા વખતો વખત વિગતવાર રજૂઆત કરેલી છે. વર્ષો પહેલા કદાચ ટેકનોલોજીના અભાવે આ બાબત અશક્ય જણાઈ હોય પણ આજના ટેકનોલોજીના યુગમાં કોઈ પણ કાર્ય અશક્ય નથી એ સુવીદિત છે ત્યારે કરમાવાદ તળાવનું સર્વે કરાવી તેમાં કેવી રીતે કુદરતી અને કુત્રિમ રીતે પાણી ભરી અને સાચવી શકાય તે જાણવું અત્યંત આવશ્યક છે કારણ કે એવું માનવામાં આવે છે આ તળાવ મા તેમજ વડગામ તાલુકામાં આવેલા અન્ય તળાવોમાં જો વરસાદી તેમજ નહેર કે પાઇપ લાઈન મારફતે પાણી નાખવામાં આવે તેમજ તે પાણી તળાવ મા સંગ્રાઈ રહે તેવી પદ્ધતિ વિકાસાવવામાં આવે તો વડગામ તાલુકાના ૧૧૦ ગામો તેમજ વડગામ તાલુકા આજુબાજુ ના પાલનપુર,દાંતા, ખેરાલુ વગેરે તાલુકામાં આવતા ગામડાઓના ભૂગર્ભ જળ ઉચે આવી શકે અથવા તો ભુગર્ભજળ નું સ્તર જાળવવામાં મદદરૂપ થઈ શકે.

વડગામ તાલુકો અને આજુબાજુ ના તાલુકાના ગામો ના મોટા ભાગના લોકો ખેતીવાડી ના રોજગાર સાથે સંકળાયેલા છે અને પાણી એ ખેતી માટે નો મુખ્ય સ્ત્રોત

છે...ટ્યુબવેલ ના ખર્ચાઓએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે એક વાર ટ્યુબવેલ બનાવ્યા બાદ પણ પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ નથી માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થારૂપે નહેરો અને પાઇપ લાઇન મારફતે મુખ્ય ડેમોમાંથી પાણી ની સુવિધા પુરી પાડી તાલુકાની ભૂગર્ભજળ ની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા પ્રયત્નો હાથ ધરાય તેવી નમ્ર વિનંતિ છે.

જ્યારે ખેતી અને પશુપાલનના ધંધા સાથે મોટા ભાગની પ્રજા જોડાયેલી હોય ત્યારે આવનાર સમય માં વડગામ તાલુકો નપાણીયો વિસ્તાર ન બની જાય અને તેની પરોક્ષ કે પ્રત્યક્ષ પ્રતિકુળ ગંભીર અસરો તાલુકાના અર્થતંત્ર પર ન પડે પરિણામ સ્વરૂપ આવનાર પેઢી તેનો ભોગ ન બને તે હેતુ પાણી પહેલા પાળ બાંધી સમયોચિત ઉપાયો હાથ ધરાય એ સમય ની માંગ છે.

આભાર સહ.

નિતીન પટેલ

www.vadgam.com